

<p>The Vice President B S E Ltd., Phiroze Jeejeebhoy Towers Dalal Street Mumbai - 400 001 BSE Code-532134</p>	<p>The Vice President, National Stock Exchange of India Ltd. Exchange Plaza, Bandra Kurla Complex Bandra (E), Mumbai - 400 051 NSE Code-BANKBARODA</p>
---	--

Dear Sir / Madam,

Re: Notice published in the Newspaper (Revised) - Extraordinary General Meeting




We enclose the text of revised newspaper advertisement published in Business Standard & Indian Express in English, Business Standard in Hindi and Sandesh in Gujarati on 09.04.2024 for Extraordinary General Meeting to be held on 15th May 2024.


We request you to take a note of the above pursuant to SEBI (LODR) Regulations, 2015 and upload the information on your website.

Yours faithfully,

P K Agarwal
Company Secretary

- Text of Advertisement published in Business Standard and The Indian Express (English) on 09.04.2024

 बैंक ऑफ़ बड़ौदा
Bank of Baroda
 
Hamesha Aapke Liye



www.bankofbaroda.in

NOTICE (REVISED)

EXTRAORDINARY GENERAL MEETING TO BE HELD THROUGH VIDEO CONFERENCING (VC) / OTHER AUDIO VISUAL MEANS (OAVM)

Further to our newspaper notice published on 29th March 2024 we notify the following:

Shareholders of the Bank may note that in pursuance of Circular(s) issued by Ministry of Corporate Affairs and Securities and Exchange Board of India (SEBI) in this regard, an Extraordinary General Meeting (EGM) of the Bank will now be held on **Wednesday, 15th May 2024** (instead of 07th May 2024) at 11:00 a.m IST through **VIDEO CONFERENCING (VC) / OTHER AUDIO VISUAL MEANS (OAVM)**, to transact the businesses that will be set forth in the Notice of the Meeting.

In compliance with the above Circulars, electronic copies of the Notice of EGM will be sent to all the shareholders whose email addresses are registered with the Bank/Depository Participant(s). Shareholders holding shares in dematerialized mode and whose email ids are not registered are requested to register their email addresses and mobile numbers with their relevant depositories through their depository participants, Shareholders holding shares in physical mode are requested to demat their holdings / furnish their email addresses and mobile numbers with KFin Technologies Limited, the Bank's Registrar and Share Transfer Agent, at einward_ris@kfintech.com. The notice of the EGM will also be made available on the Bank's website, at www.bankofbaroda.in, the Stock Exchange websites.

Shareholders will have an opportunity to cast their vote remotely on the business as set forth in the Notice of the EGM through electronic voting system. The manner of voting remotely for shareholders holding shares in dematerialized mode, physical mode and for shareholders who have not registered their email addresses will be provided in the Notice to the shareholders. The details will also be made available on the website of the Bank. Shareholders are requested to visit www.bankofbaroda.in to obtain such details.




Shareholders may please note that in terms of aforementioned circulars, the Bank will not be sending physical copy of EGM Notice to the Shareholders.


Place: Mumbai
Date: 09.04.2024

For Bank of Baroda
Debadatta Chand
Managing Director & CEO

(312024-05)

➤ Text of Advertisement published in Business Standard (Hindi) on 09.04.2024

 **बैंक ऑफ़ बड़ौदा**
Bank of Baroda
 
Hamesha Aapke Liye



www.bankofbaroda.in

सूचना (संशोधित)

वीडियो कॉन्फ्रेंसिंग (VC) / अन्य ऑडियो विज़ुअल मीडियम (OAVM) के माध्यम से आयोजित की जाने वाली असाधारण आम बैठक

हमारे द्वारा 29 मार्च, 2024 को समाचार पत्र में प्रकाशित सूचना के संबंध में हम निम्नानुसार सूचित करते हैं:

उपरोक्त विषय के संबंध में, कॉर्पोरेट मामलों के मंत्रालय और भारतीय प्रतिभूति और विनियम बोर्ड (सेबी) द्वारा जारी परिपत्र (परिपत्रों) के अनुसरण में, बैंक के शेयरधारकों को सूचित किया जाता है कि बैंक की एक असाधारण आम बैठक (ईजीएम) **बुधवार, 15 मई 2024 (07 मई 2024 के बजाय) सुबह 11:00 बजे (भारतीय समयानुसार) वीडियो कॉन्फ्रेंसिंग (वीसी) / अन्य ऑडियो विज़ुअल मीडियम (ओएवीएम) के माध्यम से आयोजित की जाएगी जिसमें बैठक हेतु दी जा रही सूचना के संबंध में निर्धारित बिन्दुओं पर कार्रवाई की जाएगी।**

उपर्युक्त परिपत्रों के अनुपालन के क्रम में, ईजीएम की सूचना की इलेक्ट्रॉनिक प्रतियां उन सभी शेयरधारकों को भेजी जाएंगी, जिनके ईमेल पते बैंक / डिपॉजिटरी प्रतिभागियों (प्रतिभागियों) के साथ पंजीकृत हैं। डिमटेरियलाइज्ड रूप में शेयर रखने वाले शेयरधारक और जिनकी ईमेल आईडी पंजीकृत नहीं हैं, से अनुरोध है कि वे अपने डिपॉजिटरी प्रतिभागियों के माध्यम से अपने संबंधित डिपॉजिटरी के साथ अपने ईमेल पते और मोबाइल नंबर पंजीकृत करें। भौतिक रूप में शेयर रखने वाले शेयरधारकों से अनुरोध किया जाता है कि वे अपनी होल्डिंग्स को डीमेट कराएं / बैंक के रजिस्ट्रार और शेयर ट्रांसफर एजेंट केफिन टेक्नोलॉजीज लिमिटेड के साथ einward.ris@kfintech.com पर अपने ईमेल पते और मोबाइल नंबर दर्ज कराएं। ईजीएम की सूचना बैंक की वेबसाइट www.bankofbaroda.in, स्टॉक एक्सचेंज की वेबसाइट पर भी उपलब्ध है।

शेयरधारकों के पास इलेक्ट्रॉनिक वोटिंग सिस्टम के माध्यम से ईजीएम के नोटिस में निर्धारित कार्य व्यवहार पर दूरस्थ रूप से अपना वोट डालने का विकल्प होगा। डिमटेरियलाइज्ड रूप, भौतिक रूप में शेयर रखने वाले शेयरधारकों और उन शेयरधारकों के लिए जिन्होंने अपने ईमेल पते पंजीकृत नहीं किए हैं, उनके लिए दूरस्थ रूप से मतदान करने के तरीकों के बारे में शेयरधारकों को नोटिस के माध्यम से सूचित किया जाएगा। विस्तृत विवरण बैंक की वेबसाइट पर भी उपलब्ध कराया जाएगा। शेयरधारकों से अनुरोध है कि वे इन विवरणों की जानकारी प्राप्त करने के लिए www.bankofbaroda.in पर विजिट करें।

उपर्युक्त परिपत्रों के संदर्भ में शेयरधारक कृपया ध्यान दें कि बैंक शेयरधारकों को ईजीएम नोटिस की भौतिक प्रति नहीं भेजेगा।

स्थान: मुंबई
दिनांक: 09.04.2024

कृते बैंक ऑफ़ बड़ौदा
देबदत्त चांद
प्रबंध निदेशक और मुख्य कार्यपालक अधिकारी

(30204-25)

➤ Text of Advertisement published in Sandesh (Gujarati) on 09.04.2024

 **बैंक ऑफ़ बड़ौदा**
Bank of Baroda
 
Hamesha Aapke Liye



www.bankofbaroda.in

सुधारित नोटिस

**असाधारण सामान्य सभा विडियो कन्फ्रन्सिंग (वीसी) /
अन्य ओडियो विड्युअल माध्यमो (ओએवीએમ) થકી હાથ ધરાશે**

અમારી 29મી માર્ચ, 2024ના રોજ પ્રસિદ્ધ અખબારી સૂચનાને અનુલક્ષી અમે નિમ્નલિખિત જાણકારી આપવા માગીએ છીએ:

બેન્કના શેરહોલ્ડરો નોંધ કરે કે આ સંબંધમાં કોર્પોરેટ બાબતોના મંત્રાલય અને સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) દ્વારા જારી પરિપત્રક(કો) અંતર્ગત બેન્કની અસાધારણ સામાન્ય સભા (ઈજીએમ) (7 મે, 2024ને બદલે) **બુધવાર, 15 મે, 2024 ના રોજ** ભારતીય સમય અનુસાર સવારે 11:00 કલાકે બેન્કની સૂચનામાં આપ્યા મુજબ કામકાજ હાથ ધરવા માટે **વિડિયો કોન્ફરન્સિંગ (વીસી)/અધર ઓડિયો વિડ્યુઅલ મીન્સ (ઓએવીએમ)** થકી હાથ ધરાશે.

ઉક્ત પરિપત્રકો અંતર્ગત ઈજીએમની નોટિસની ઇલેક્ટ્રોનિક કોપીઓ અને બેન્ક / ડિપોઝિટરી સહભાગી(ઓ) પાસે જેમનાં ઇમિઇલ સરનામાં નોંધાયેલાં છે તે બધા શેરહોલ્ડરોને મોકલવામાં આવશે. ડીમટીરિયલાઈઝ્ડ માધ્યમમાં શેરો ધરાવતા શેરહોલ્ડરો અને જેમનાં ઇમિઇલ સરનામાં નોંધણી કર્યાં નથી તેમને તેમનાં ઇમિઇલ સરનામાં અને મોબાઇલ નંબરો તેમની ડિપોઝિટરી સહભાગીઓ થકી તેમની સંબંધિત ડિપોઝિટરીઓ પાસે નોંધાવવાની વિનંતી છે. પ્રત્યક્ષ માધ્યમમાં શેરો ધરાવતા શેરહોલ્ડરોને તેમના હોલ્ડિંગ્સ ડિમેટ કરવાની / તેમનાં ઇમિઇલ સરનામાં અને મોબાઇલ નંબરો inward.ris@kfintech.com પર કેફિન ટેકનોલોજીઝ પ્રાઇવેટ લિમિટેડ, બેન્કના રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ ને આપવાની વિનંતી છે. ઈજીએમની નોટિસ બેન્કની વેબસાઇટ www.bankofbaroda.in પર, શેરબજારોની વેબસાઇટો પર પણ ઉપલબ્ધ કરાશે.

શેરહોલ્ડરોને ઇલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ થકી ઈજીએમની નોટિસમાં આપ્યા મુજબ કામકાજ પર દૂરથી તેમના મત આપવાની તક મળશે. ડીમટીરિયલાઈઝ્ડ માધ્યમ, પ્રત્યક્ષ માધ્યમમાં શેરો ધરાવતા શેરહોલ્ડરો અને તેમનાં ઇમિઇલ સરનામાં નોંધાયેલાં નથી તેવા શેરહોલ્ડરો માટે દૂરથી મતદાન આપવાની પદ્ધતિ શેરહોલ્ડરો માટેની નોટિસમાં આપવામાં આવશે. વિગતો બેન્કની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ કરાશે. શેરહોલ્ડરોને આવી વિગતો પ્રાપ્ત કરવા માટે www.bankofbaroda.in ની વિક્રિટ કરવાની વિનંતી છે.

શેરહોલ્ડરો કૃપા કરીને એ ધ્યાનમાં લે કે ઉક્ત ઉદ્દેશિત પરિપત્રકોની દષ્ટિથી બેન્ક ઈજીએમની નોટિસની પ્રત્યક્ષ નકલો નહીં મોકલે.

બેન્ક ઓફ બરોડા વતી
દેબદત્તા ચાંદ,
મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ

સ્થળ: મુંબઈ
તારીખ: 09.04.2024

(32024-25)